

## કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ દ્વારા ખાતરના યોગ્ય ઉપયોગ અંગેનો જાગૃતિ કાર્યક્રમ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ અને આત્મા, આણંદના સહયોગથી તા.૨૨.૧૦.૨૦૧૯ના રોજ ક્ષેમકલ્યાણી માતા મંદિર, સોજીત્રા ખાતે ખાતરના યોગ્ય ઉપયોગ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આજુબાજુના ગામના ૧૫૨ ખેડૂત ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. સદર કાર્યક્રમમાં ડો. એમ.બી. વીરડીયા, સહ પ્રાધ્યાપક, કૃષિ રસાયણ શાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ, બી.એ.સી.એ., આ.કૃ.યુ., આણંદ, પ્રો.એસ.વી. રાઠોડ, કૃષિ રસાયણ શાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ, બી.એ.સી.એ., આ.કૃ.યુ., આણંદ અને શ્રી મારુત ધામી, જી.એન.એફ.સી., વડોદરા તથા શ્રી લાભેશભાઈ શાસ્ત્રી, સરપંચશ્રી, દેવાતજ તથા કે.વિ.કે.ના વૈજ્ઞાનિકો અને સર્વે સ્ટાફ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. આર. એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા ઉપસ્થિત સર્વેનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેઓએ પ્રાસંગીચિત ઉદબોધન કર્યું. ત્યારબાદ ડો. એમ.બી. વીરડીયા, સહ પ્રાધ્યાપક, કૃષિ રસાયણ શાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ, બી.એ.સી.એ., આ.કૃ.યુ., આણંદએ રવિ પાકોમાં ખાતરનું યોગ્ય વ્યવસ્થાપન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી. પ્રો.એસ.વી. રાઠોડ, કૃષિ રસાયણ શાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ, બી.એ.સી.એ., આ.કૃ.યુ., આણંદ એ જમીન ચકાસણી તથા જમીનની તંદુરસ્તી જાળવવા માટેના અગત્યના મુદ્દાઓ વિશે માહિતી આપી. કે.વિ.કે.ના વૈજ્ઞાનિક (એગ્રોનોમી) ડૉ. વાચ.સી. લકુમ દ્વારા સંતુલિત ખાતર વ્યવસ્થાપન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ખેડૂતોને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ વિષેની વિડીયો ફીલ્મ બતાડવામાં આવેલ ત્યારબાદ બપોરે ૧૨.૩૦ કલાકે ખેડૂતો માટે ખાતરના યોગ્ય ઉપયોગ અંગેના જાગૃતિ કાર્યક્રમના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ બતાવવામાં આવેલ જેમાં માનનીય કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તથા માનનીય ખાતર મંત્રી દ્વારા ખેડૂતોને સંબોધવામાં આવેલ.

કાર્યક્રમના અંતે કે.વિ.કે. સ્ટાફ દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી.

## કાર્યક્રમની ઝાંખીઓ

